

કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ. આણંદ ખાતે

“માછલી તથા જીંગા ઉછેર”

વિષય ઉપર યોજાયેલ એક દિવસીય તાલીમ કાર્યક્રમ

આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે આવેલ બં.અ.કૃષિ મહાવિદ્યાલયના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ તરફથી “માછલી તથા જીંગા ઉછેર” વિષય ઉપર તારીખ ૨૨ ઓગષ્ટ ૨૦૧૭ ને મંગળવારના રોજ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માછલી તથા જીંગા ઉછેર સાથે સંકળાયેલ સારોલ, મોજપુર, ગાજણા અને વડોદ, સોજીત્રા, કરમસદ તથા વાલવોડ એમ છ અલગ અલગ ગામો માંથી કુલ ૫૦ તાલીમાર્થી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.



તાલીમાર્થીઓના રજીસ્ટ્રેશન બાદ તાલીમ કાર્યક્રમનું વિધિવત્ત ઉદઘાટન બં. અ. કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. કે. પી. પટેલ, વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ. કે. એસ. જાદવ, સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશ વોટર એક્વાકલ્ચર (CIFA) ના વડા ડૉ. સી. કે. મિશ્રા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી આણંદથી પધારેલ શ્રી રસીકભાઈ મકવાણા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના વૈજ્ઞાનિક પ્રો. જે. એચ. ભટ્ટની ઉપસ્થિતિમાં થયું. સમગ્ર આયોજન ડૉ. એ. એસ. શેખ તથા શ્રી જીજ્ઞેશ મેકવાણ દ્વારા કરવામાં આવ્યું.

તાલીમ કાર્યક્રમને અનુલક્ષીને તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ સંપૂર્ણ વિતરણ કર્યા બાદ ડૉ. કે. એસ. જાદવ દ્વારા સંબંધિત વિષય અંગે માહિતી આપવામાં આવી. ત્યારબાદ પ્રો. જે. એચ. ભટ્ટ દ્વારા મીઠા પાણીની માછલી તથા જીંગા ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિ, ડૉ. સી. કે. મિશ્રા દ્વારા સાયન્ટીફિક એક્વાકલ્ચર પ્રેક્ટાઈસીસ અને એક્સ્પોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટીંગ તથા શ્રી રસીકભાઈ મકવાણા દ્વારા માછલી તથા જીંગા ઉછેરનું અર્થકરણ તેમજ સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓ વગેરે વિષય અંગે તાલીમાર્થીઓને પરિચિત કરવામાં આવ્યા.

થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી, ગામડી ગામ, આણંદ મુકામે આવેલ માછલી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી તેમજ દિવસના અંતે તાલીમાર્થીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને જરૂરી બધીજ માહિતી મળી છે.



કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે તાલીમાર્થીઓને માછલી તથા જીંગા ઉછેરની તાલીમ અંગેના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંતે તાલીમના સંચાલક ડૉ. એ. એસ. શેખ દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

